

RAN-2008060104020001
M. Com. (Sem.-IV) Examination March - 2026
Financial Management - II (Paper-II)
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) બધા જ પ્રશ્નોના જવાબ આપો. Attempt all Questions. (3) જમણી બાજુના આંકડા દરેક પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figures to the right indicate marks of each question.	Seat No.: Student's Signature
--	--

- Q. 1. નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો :** **10**
1. આડા અને ઊભા વિલીનીકરણને વ્યાખ્યાયિત કરો.
 2. અમૂર્ત સંપત્તિ શું છે? તેની લાક્ષણિકતાઓ જણાવો.
 3. કોપી રાઈટ્સ અને વેપાર ચિહ્ન વ્યાખ્યાયિત કરો.
 4. વિદેશી પોર્ટફોલિયો રોકાણ શું છે? રોકાણકારોને તેના ફાયદા જણાવો.
 5. સંયુક્ત સાલસ શું છે? તેના પ્રકારો જણાવો.
- Q. 2. (a) પ્રતિકૂળ ટેકઓવર અટકાવવા માટે સક્રિય પગલાં વ્યાખ્યાયિત કરો.** **7**
- (b) વિનિમય નિર્ણયના નાણાકીય મૂલ્યાંકન વિશે વિગતવાર ચર્ચા કરો.** **7**
- અથવા**
- Q. 2. (a) નાણાકીય લીઝ અને કાર્યકારી લીઝ વચ્ચે તફાવત કરો.** **7**
- (b) નાણાકીય વિશ્લેષણ અને અર્થઘટનના ઉદ્દેશ્યો સમજાવો.** **7**
- Q. 3. (a) લીવરેજ શું છે? સંચાલન લીવરેજ અને નાણાકીય લીવરેજને વિગતવાર સમજાવો.** **7**
- (b) રૂપાંતરીત ડિબેન્ચર શું છે? રૂપાંતરીત ડિબેન્ચર શા માટે જારી કરવામાં આવે છે? સમજાવો.** **7**
- અથવા**
- Q. 3. (a) એજન્સી ખર્ચ શું છે? એજન્સી ખર્ચ ધરાવતા ઉપકરણો સમજાવો.** **7**
- (b) નાણાકીય વ્યવસ્થાપન પર મંદીની અસર વિશે ચર્ચા કરો.** **7**
- Q. 4. (a) નોંધ લખો (કોઈપણ એક):** **4**
- (i) ભાડા ખરીદી
 - (ii) વિદેશમાં રોકાણ કરવાના કારણો.

ગુણોત્તર/વર્ષ	2015	2016	2017	2018	2019
દેવા ઇક્વિટી ગુણોત્તર	2.5:1	3:1	2:1	3.5:1	2.5:1
કુલ દેવા અસ્ક્યામતો ગુણોત્તર	50%	52%	55%	57%	60%
ચાલુ ગુણોત્તર	2:1	2:1	2.5:1	1.5:1	1.5:2
દેવા ટર્નઓવર ગુણોત્તર	5	6	7	4	6

ઉપરોક્ત ગુણોત્તરના નાણાકીય પરિણામો સમજાવો.

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in short:** 10
1. Define horizontal and vertical merger.
 2. What is intangible assets? State its characteristics.
 3. Define copy rights and trade mark.
 4. What is foreign portfolio investment? State its benefits to investors.
 5. What is joint venture? State its types.
- Q. 2. (a) Define active measures for prevention of hostile takeover.** 7
- (b) Discuss about financial evaluation of divestiture decision in detail.** 7
- OR**
- Q. 2. (a) Differentiate between financial lease and operational lease.** 7
- (b) Explain objectives of financial analysis and interpretation.** 7
- Q. 3. (a) What is leverage? Explain operating leverage and financial leverage in detail.** 7
- (b) What is convertible debenture? Why do convertible debentures are issued? Explain.** 7
- OR**
- Q. 3. (a) What is agency cost? Explain devices containing agency cost.** 7
- (b) Discuss about impact of recession in financial management.** 7
- Q. 4. (a) Write Note on (Any One):** 4
- (i) Hire purchase
 - (ii) Reasons for investing abroad.

(b) The ratios of last five years of Aarav Ltd. Is given below:

8

Ratio/Year	2015	2016	2017	2018	2019
Debt Equity Ratio	2.5:1	3:1	2:1	3.5:1	2.5:1
Total Debt Assets Ratio	50%	52%	55%	57%	60%
Current Ratio	2:1	2:1	2.5:1	1.5:1	1.5:2
Debtors Turnover Ratio	5	6	7	4	6

Explain the financial implications of the above ratios.
